



મુખ્ય મંત્રી અમૃતમમા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના

- ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા અંદાજે ૪૧. ૪૫લાખ કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ(મા)યોજના તા.૪/૯/૨૦૧૨થી અમલમાં મુકેલ.
- યોજનાની સફળતાને ધ્યાને લઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા)યોજના નો વ્યાપ વધારીવર્ષ ૨૦૧૪-૧૫માં “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતામધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરનાબાળકો ” માટે મુખ્યમંત્રી અમૃતમ“મા વાત્સલ્ય”યોજના ૧૫/૦૮/૨૦૧૪ થી અમલી કરેલ છે.
- “મા વાત્સલ્ય” યોજનાને પણ વ્યાપક આવકાર મળતાં રાજ્યનાં કલ્યાણ માટે હવે પુરૂષો માટેની ૨૧ વર્ષની વય મર્યાદાની જોગવાઈ ૨૦૧૫-૧૬નાં નાણાંકીય વર્ષમાં ૨૬ કરેલ છે. જેથી હવે રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતામધ્યમ વર્ગના પરિવારના કોઈપણ સભ્યો (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિ) “મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભો મેળવી શકે છે.
- ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કુટુંબના મહત્તમ ૫ વ્યક્તિને (કુટુંબના વડા, પત્નીવ અને ૩ આશ્રિતો) લાભ મળવાપાત્ર છે.નવજાત શીશુને છઠ્ઠા સભ્ય તરીકે આ યોજનામાં આવરી લેવામાં આવે છે.
- યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિ ટલ ખાતે સારવાર હેતુ આવવા- જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/- ચુકવવામાં આવે છે.
- ગંભીર બિમારીઓ માટે લાભાર્થી કુટુંબોને “મા” તથા “મા વાત્સલ્ય” યોજના હેઠળ:-
- બર્નસબ(દાઝેલક્ષ્મી)દયના ગંભીર રોગો ,ક્રીડનીના ગંભીર રોગો ,મગજના ગંભીર રોગો ,ગંભીર ઇજાઓ,નવજાત શિશુઓના ગંભીર રોગો ,કેન્સર(કેન્સર સર્જરી , કેમોથેરાપી તથા રેડીઓથેરાપી) જેવી બિમારીઓની કુલ- ૫૪૪ જેટલી પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.

“મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ:-

- યોજનાહેઠળ લાભાર્થીના કુટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું QR (Quick response) “મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ આપવામાં આવે છે.કાર્ડ દ્વારાલાભાર્થીઓની યોગ્ય ઓળખ કરી શકાય છે અને ખોટા લાભાર્થીઓને ઓળખી તેને કાબુમાં રાખી શકાય છે.
- “મા” તથા “મા વાત્સલ્ય” યોજનાનું કાર્ડ યોજના હેઠળ સ્થાપિત તાલુકા કિઓસ્ક/સીવીક સેન્ટર કિઓસ્ક પર રથી મેળવી શકાય છે. નોંધણીમાટેતાલુકાકક્ષાએરરઝકિઓસ્કતેમજપર (બાવન) સીટીસીવીકકક્ષાએ સેન્ટરઉભાકરવામાંઆવ્યાછે.

- “માવાત્સલ્ય”યોજના હેઠળ “માવાત્સલ્ય” કાર્ડ કઢાવવું ફરજિયાત છે. જેના માટે નીચે જણાવેલ નિયત (અધિકૃત) અધિકારીઓ પૈકી ગમે તે એક અધિકારી પાસેથી રૂ. ૧.૨૦ લાખ(એક લાખ વીસ હજાર પુરા)થી ઓછી પારિવારીક વાર્ષિક આવક ધરાવે છે તે પ્રમાણેનો આવકનો દાખલો લાભાર્થી પરિવારે મેળવવાનો રહે છે.
- જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટરશ્રી/મદદનીશ કલેક્ટર/પ્રાંત ઓફીસર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર/સીટી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર

કેશલેસ સારવાર:-

- યોજના હેઠળ લાભાર્થીઓ માટે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન,નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે, હોસ્પિટલ આ બધા માટે કોઈ જ ચાર્જ વસુલ કરી શકે નહીં. આમ, “મા” અને “મા વાત્સલ્ય”યોજના હેઠળ લાભાર્થી તદ્દન મફત સારવાર મેળવી શકે છે.
- યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.



- “મા” કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલ ઇડખાનગી જેવી કે, સ્ટ લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ, નારાયણ રૂદ્રાલય, બેન્કસર્સ હાર્ટ, સત્ય સાંઘ, કૈલાશ કેન્સર, ભારત કેન્સટર, એચ.સી.જી. મેડીસર્જ વિગેરે તેમજ ૧૯ સરકારી જેવી કે, યુ.એન.મહેતા, કીડની હોસ્પિટલ, ગુજરાત કેન્સર હોસ્પિટલ વિગેરે સારી સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં જઈ ને લાભ લઈ શકે છે.

- રાજ્ય સરકારીશ્રી દ્વારા યોજનાની બહોળી પ્રસિધ્ધિ માટે પ્રચાર પ્રસારની કામગીરી જેમ કે મેગા હેલ્થ કેમ્પ , હેલ્થ કેમ્પ , રેડીયો, ટી.વી., ન્યુઝ પેપરદ્વારા કરવામાં આવે છે અને આશા બહેનોને રૂ. ૧૦૦/- રજીસ્ટ્રેશન ફી પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે.



યોજનાની વિશેષતા :-

- મુખ્યમંત્રી અમૃતમ“મા”અને “મા વાત્સલ્ય”યોજના યોજના હેલ્થ એસ્યોરન્સ આધારિત છે જેમાં કોઈ પણ વીમા કંપનીનો સમાવેશ થતો નથી.
- મુખ્યમંત્રી અમૃતમ“મા”અને “મા વાત્સલ્ય ”યોજના હેઠળ સ્પર્ધાત્મક ઇ-ટેન્ડરિંગ (ટેકનીકલ અને ફાઇનાન્સીયલ બીડ) મારફતે બજારભાવેવિવિધ પ્રોસીઝરના પેકેજ રેટ નક્કી કરવામાં આવેલ.
- યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલ પાસે NABH/JCI/ACHS or any other accreditation body approved by International society for Quality in Healthcareનું પ્રમાણપત્ર હોય અને તેમાં રજીસ્ટર થયેલી હોય તેમને રાજ્ય ધ્વારા “મા” પેકેજ દરો કરતા ૧૦% વધારે ક્વોલિટી ઇન્સેન્ટીવ આપવામાં આવે છે.

યોજના હેઠળ મેળવેલ સિધ્ધિ:-

- મુખ્યમંત્રી અમૃતમયોજનાને ૨૦, સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સ્માર્ટ ગવર્નન્સ ૨૦૧૪માટે પ્રતિષ્ઠિત PlatinumSKOCH Awardsઆપવામાં આવેલ.

- મુખ્યમંત્રી અમૃતમયોજનાને ૧૩, ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ પ્રતિષ્ઠિત CSI-Nihilent e-Governance Awards આપવામાં આવેલ.
- મુખ્યમંત્રી અમૃતમ“મા” અને“મા વાત્સલ્ય”યોજનાનું અમલીકરણ SNC (સ્ટેટ નોડલ સેલ) દ્વારા કરવામાં આવે છે.
- યોજના અંતર્ગત ક્લેઇમ્સ પ્રોસેસ , હોસ્પિટલ એમ્પોનલમેન્ટ , આઇ.ઇ.સી પ્રવૃત્તિઓ માટે (ISA) - ઇમ્પ્લીમેન્ટેશન સપોર્ટ એજન્સી - એમ. ડી. ઇન્ડીયા હેલ્થકેર નેટવર્ક્સ પ્રા.લી. કંપની નિયુક્ત કરેલ છે. તથા એનરોલમેન્ટ માટે , સોફ્ટવેર એપ્લિકેશન બનાવવા , લાભાર્થીઓને “મા” કાર્ડ આપવા માટે આઇ.ટી સપોર્ટ એજન્સી તરીકે એન. કોડ સોલ્યુસન્સ પ્રા.લી. નિયુક્ત કરેલ છે.
- મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના ની વધુ જાણકારી મળી રહે તે માટે ટોલફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ તેમજ www.magujarat.com વેબસાઇટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.